

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત  
તુલનાત્મક સાહિત્ય વિભાગ  
વિષય: તુલનાત્મક સાહિત્ય  
એમ.એ.પાર્ટ: ૨ (અભેદનાલ)

વર્ષ સને: ૨૦૨૦-૨૦૨૧, ૨૦૨૧-૨૦૨૨, ૨૦૨૨-૨૦૨૩

હેતુ : પ્રભાવલક્ષી અભ્યાસકેત્રનો ખ્યાલ વિદ્યાર્થી મેળવે. સંસ્કૃત જેવા સમૃદ્ધ ભાષા સાહિત્યના અન્ય ભાષાઓ પર પડેલા પ્રભાવ વિશેની સમજ વિદ્યાર્થી કેળવે.

### **Paper : 6 : Core: 4 પ્રભાવલક્ષી અભ્યાસ: (સંસ્કૃતનો પ્રભાવ)**

- એકમ:૧ (૧) તુલનાત્મક સાહિત્ય અને પ્રભાવલક્ષી અભ્યાસ  
(૨) રામાયણ - મહાકાવ્યનો પરિચય  
(૩) મહાભારત - મહાકાવ્યનો પરિચય

- એકમ:૨ (૧) સંસ્કૃતનો ભારતીય સાહિત્ય પર પ્રભાવ  
(૨) સંસ્કૃતનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ  
(૩) સંસ્કૃતનો હિન્દી સાહિત્ય પર પ્રભાવ

- એકમ:૩ રશ્મિરથી (હિન્દી): રામધારીસિંહ દિનકર  
એકમ:૪ મૃત્યુંજ્ય (મરાಠી) શિવાજી સાવંત  
એકમ:૫ કર્ણ - કૃષ્ણ : ઉમાશંકર જોશી

**નોંધ:** ત્રણો કૃતિઓની તુલના અપેક્ષિત છે.

#### **સંદર્ભ પુસ્તકો :**

- (૧) સંસ્કૃત નાટ્ય સાહિત્ય - રસિકલાલ પરીખ  
(૨) સંસ્કૃત સાહિત્ય મંથન - જ્યાનંદ દવે  
(૩) ઉમાશંકર જોશી ભાગ ૧ થી ૩ - સં. ચંદ્રકાન્ત શેઠ  
(૪) યુગદ્ભા ઉમાશંકર જોશી - સં. ચંદ્રકાન્ત શેઠ  
(૫) અર્વાચીન ભારતીય સાહિત્ય પર સંસ્કૃતનો પ્રભાવ (પૂર્વાપર) ભોગાભાઈ પટેલ  
(૬) રામાયણ એક પરિચય - નિરંજન શાહ  
(૭) રશ્મિરથી (હિન્દી): રામધારીસિંહ દિનકર  
(૮) મૃત્યુંજ્ય (મરાಠી) શિવાજી સાવંત  
(૯) કર્ણ - કૃષ્ણ : ઉમાશંકર જોશી

હેતુ : બિન્ન ભાષાના કર્તાઓ તથા તેઓની ફૂટિઓના પરિચય દ્વારા કર્તાની સર્જક પ્રતિભા અને સર્જનસૃષ્ટિને પામી શકાય.

### **Paper : 7 : Core: 5 કર્તાલક્ષી અભ્યાસ**

- એકમ:૧ (૧) સર્જક વ્યક્તિત્વને ઘડનારાં પ્રેરકબળો  
(૨) સર્જકની સર્જનસૃષ્ટિ  
(૩) આધુનિક ભારતીય નાટ્ય સૃષ્ટિ

- એકમ:૨ (૧) આધુનિક નાટ્યકાર તરીકે લાભંશકર ઠાકરનું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન  
(૨) આધુનિક નાટ્યકાર તરીકે વિજય તેંડુલકરનું મરાઠી સાહિત્યમાં પ્રદાન  
(૩) આધુનિક નાટ્યકાર તરીકે મોહન રાડેશનું હિન્દી સાહિત્યમાં પ્રદાન

એકમ:૩ પીળું ગુલાબ અને હું (ગુજરાતી) લાભંશકર ઠાકર

એકમ:૪ ધાશીરામ કોતવાલ (મરાઠી) વિજય તેંડુલકર

એકમ:૫ અખાઢ કા એક દિન (હિન્દી) મોહન રાડેશ

**નોંધ:** ત્રણે નાટ્યકારોની તુલના અપેક્ષિત છે.

#### **સંદર્ભ પુસ્તકો :**

- (૧) ભારતીય નાટ્યશાસ્ત્રની વિચાર પરંપરાઓ: તપસ્વી નાન્દી, ગ્રંથ નિર્માણ બોર્ડ.  
(૨) આધુનિક ગુજરાતી નાટક: પ્રત અને પ્રયોગ: મહેશ ચંપકલાલ  
(૩) મોહન રાડેશ કા નાટ્ય સાહિત્ય: પુષ્યા બંસલ, સૂર્ય પ્રકાશન, નવી દિલ્હી.  
(૪) મોહન રાડેશ ઔર ઉનકે નાટક: જિરીશ રસ્તોગી, લોકમારતી પ્રકાશન, અલાહાબાદ  
(૫) મોહન રાડેશ કી રંગ-સૃષ્ટિ: જગદીશ શર્મા, રાધાકૃષ્ણ પ્રકાશન દિલ્હી.  
(૬) મોહન રાડેશ કે નાટક: દ્વિજરામ યાદવ, કાનપુર  
(૭) ધાશીરામ કોતવાલ (મરાઠી) વિજય તેંડુલકર  
(૮) પીળું ગુલાબ અને હું (ગુજરાતી) લાભંશકર ઠાકર  
(૯) અખાઢ કા એક દિન (હિન્દી) મોહન રાડેશ

**હેતુ :** તુલનાત્મક સાહિત્યમાં અનુવાદનું મહત્વ વિશેની સમજ કેળવાય તથા અનુવાદની સૈદ્ધાંતિક વિચારણા તથા વિનિયોગ દ્વારા તેની સમજ કેળવાય.

## Paper : 8 : Core: 6 અનુવાદ : સિદ્ધાંત અને વિનિયોગ

- |              |   |
|--------------|---|
| <b>એકમ:૧</b> | (૧) તુલનાત્મક સાહિત્ય અને અનુવાદની અનિવાર્યતા<br>(૨) અનુવાદ, ભાષાન્તર, તરજૂમો--- શબ્દ અને તેના અર્થો<br>(૩) અનુવાદ-વિજ્ઞાન કે કણા?<br>(૪) અનુવાદ; અનુવાદ પ્રવૃત્તિ અને અનુવાદના સ્વરૂપ વિશે વિવિધ વિદ્વાનોનાં મંતવ્યો                     |
| <b>એકમ:૨</b> | (૧) સર્જનાત્મક અને ચિંતનાત્મક ગદ્ય કૃતિઓના અનુવાદો અને તેની સમસ્યાઓ<br>(૨) કાવ્યકૃતિ-પદ્યાનુવાદો અને તેની સમસ્યાઓ<br>(૩) અનુવાદક-સંસૂચિનાં દૂત તરીકે<br>(૪) અનુવાદ અને સાંસૂચિક સંદર્ભો   |
| <b>એકમ:૩</b> | (૧) અનુવાદ પ્રવૃત્તિના છિત્તિહાસની રૂપરેખા<br>યુરોપીય ભાષાઓમાંથી ગુજરાતીમાં થયેલા અનુવાદો<br>ભારતીય ભાષાઓમાંથી ગુજરાતીમાં થયેલા અનુવાદો<br>(૨) મશીન ટ્રાન્સલેશન<br>(૩) બહુભાષી રાષ્ટ્રમાં અનુવાદની પ્રવૃત્તિ<br>(૪) ભારતીય અનુવાદક પરંપરા |
| <b>એકમ:૪</b> | ગુજરાતીમાંથી હિન્દીમાં અનુવાદ (કેટલીક નમૂનારૂપ કૃતિઓ, કેટલાંક પરિચ્છેદો, સર્જનાત્મક)  |
| <b>એકમ:૫</b> | હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદ (કેટલીક નમૂનારૂપ કૃતિઓ, કેટલાંક પરિચ્છેદ)   |

### મહત્વના સંદર્ભ :

- (૧) ‘અનુવાદ- સિદ્ધાંત અને સમીક્ષા’- સંપા. રમણ સોની સાહિત્ય અકાદમી, નવી દિલ્હી - ૨૦૦૮
- (૨) જોશી, ઉમાશંકર : ‘કવિની સાધના’.
- (૩) વિશ્વનાથ અય્યર : ‘અનુવાદકલા’ અનુ. નવનીત મદ્રાસી : આદર્શ પ્રકાશન, અમદાવાદ-૨૦૦૭
- (૪) પરીખ, ધીરુ : ‘તુલનાત્મક સાહિત્ય’.
- (૫) બ્રહ્મભણ, પ્રસાદ : ‘તુલનાત્મક સાહિત્ય : સિદ્ધાંત અને વિનિયોગદ્વારા’.
- (૬) બાપટ, વસંત : ‘તુલનાત્મક સાહિત્યાત્યાસ’.
- (૭) પટેલ, મોહન : ‘અનુવાદ વિજ્ઞાન’.
- (૮) ઠાકોર, રવીન્દ્ર : અનુવાદકલા
- (૯) પટેલ, ભોળાભાઈ : અનુવાદક શ્રી રમણલાલ સોની
- (૧૦) દલાલ, અનિલા : અનુવાદક ભોળાભાઈ
- (૧૧) દેસાઈ, કેશુભાઈ : અનુવાદ : શાસ્ત્રીય કણા
- (૧૨) દેસાઈ, કેશુભાઈ : અનુવાદ વિશે.

**હેતુ :** ભારતીય સાહિત્ય વિશેની સમજ વિદ્યાર્થી કેળવે અને ભારતીય સાહિત્યની સાથે સંસ્કૃતિ, સમાજ અને પરંપરાઓનો પરિચય પણ મેળવે.

### **Paper : 9 : Elective: 2 (A) ભારતીય સાહિત્ય**

- |              |   |
|--------------|---|
| <b>એકમ:૧</b> | (૧) ભારતીય સાહિત્યની વિભાવના<br>(૨) ભારતીય સાહિત્યમાં સમાજ અને સંસ્કૃતિ<br>(૩) ભારતીય સાહિત્ય વિશે સુનીતિકુમાર ચેટરજી અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી   |
| <b>એકમ:૨</b> | (૧) તુલનાત્મક સાહિત્યનો ખ્યાલ ભારતીય સંદર્ભ - અમીય દેવ<br>(૨) ભારતીય સાહિત્ય વિશે ઈન્દ્રનાથ ચૌધરી<br>(૩) ભારતીય સાહિત્ય વિશે નગેન્દ્ર<br>(૪) તુલનાત્મક ભારતીય સાહિત્ય વિશે - શિશિરકુમાર દાસ |
| <b>એકમ:૩</b> | ઝેર તો પીધાં છે જાણી જાણી (ગુજરાતી): દર્શક  |
| <b>એકમ:૪</b> | ઇ બીધા જમીન (ઓડિયા): ફીરમોહન સેનાપતિ  |
| <b>એકમ:૫</b> | બનગરવાડી (મરાઠી): વંકટેસ માડગૂળકર   |

**નોંધ:** ત્રાણે કૃતિઓની તુલના અપેક્ષિત છે.

#### **સંદર્ભ પુસ્તકો :**

- (૧) ભારતીય સાહિત્ય પરંપરાનો વિસ્તાર - ભોળાભાઈ પટેલ
- (૨) ભારતીય નવલક્ષ્ય - રમણલાલ જોશી
- (૩) જ્ઞાન ગંગોત્રી શ્રેષ્ઠી - ભારતીય સાહિત્ય
- (૪) ભારતીય સાહિત્ય - ડે. સચ્ચિદાનંદ
- (૫) ભારતીય સાહિત્યની ભૂમિકા - ડૉ. રામ વિલાસ શર્મા
- (૬) જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલક્ષ્ય - સં. ભરત મહેતા
- (૭) ભારતીય નવલક્ષ્ય - સં. બિપિન આશર
- (૮) તુલનાત્મક સાહિત્ય: ભારતીય સંદર્ભ- ડૉ. ચૈતન્ય દેસાઈ
- (૯) તુલનાત્મક સાહિત્ય: વિદેશી સંદર્ભ- ડૉ. ચૈતન્ય દેસાઈ
- (૧૦) ઝેર તો પીધાં છે જાણી જાણી (ગુજરાતી): દર્શક
- (૧૧) ઇ બીધા જમીન (ઓડિયા): ફીરમોહન સેનાપતિ
- (૧૨) બનગરવાડી (મરાઠી): વંકટેસ માડગૂળકર

હેતુ : વિદ્યાર્થી વિશ્વસાહિત્યનો પરિચય પામે. કૃતિઓના આસ્વાદથી વિશ્વસાહિત્ય વિશેની સમજ કેળવે.

### Paper :9 : Elective: 2 (B) વિશ્વસાહિત્ય

- એકમ:૧ (૧) વિશ્વસાહિત્ય: સંજ્ઞા, પરિબળો અને લક્ષણો  
(૨) ગ્રીક મહાકાવ્યોનો પ્રાથમિક પરિચય

- એકમ:૨ (૧) અંગ્રેજી સાહિત્યનો પરિચય  
(૨) ફેન્ચ સાહિત્યનો પરિચય  
(૩) જર્મન સાહિત્યનો પરિચય

એકમ:૩ ધી આઉટસાઈડર (ફેન્ચ): આલ્બેર કામુ

એકમ:૪ એનિમલ ફાર્મ: (અંગ્રેજી): જ્યોર્જ ઓરવેલ: અનુ.: જ્યંતી દલાલ

એકમ:૫ સિદ્ધાર્થ (જર્મન) હરમન હેસ

### સંદર્ભ પુસ્તકો :

૧. સાહિત્યદર્શન (વિશ્વસાહિત્ય:૧)- સં.દિગીશ મહેતા અને અન્ય
૨. અંગ્રેજી સાહિત્યનું આચ્યમન- મધુસૂદન પારેખ, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, ૧૯૮૮
૩. પાશ્વાત્ય ટૂંકીવાર્તા- ઈલા પાઠક, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૭૫
૪. પાશ્વાત્ય નવલકથા- દિગીશ મહેતા, હર્ષદ દેસાઈ, ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ
૫. દેશાન્તર - અનિલા દલાલ, ગૂર્જર પ્રકાશન, અમદાવાદ
૬. દર્પણાનું નગર - અનિલા દલાલ, આર. આર. શેઠની કંપની, અમદાવાદ, ૨૦૦૭
૭. વિશ્વની નવલકથા - સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૭
૮. વિપુલા ચ પૃથ્વી - પ્રવીણ દરજી, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, ૧૯૯૨
૯. પાંચ મહાકાવ્યો - સં. ધીરુ પરીખ, કવિલોક પ્રકાશન, અમદાવાદ
૧૦. રશિયન સાહિત્ય - ભોગીલાલ ગાંધી
૧૧. મદ્રાસી, નવનીત (અનુ.): 'ગુડ અર્થ', અમે.કે. મદ્રાસી, શબ્દલોક પ્રકાશન, અમદાવાદ-૭
૧૨. ધી આઉટસાઈડર (ફેન્ચ): આલ્બેર કામુ
૧૩. એનિમલ ફાર્મ: (અંગ્રેજી): જ્યોર્જ ઓરવેલ: અનુ.: જ્યંતી દલાલ
૧૪. સિદ્ધાર્થ (જર્મન) હરમન હેસ

**હેતુ :** તુલનાત્મક સાહિત્યમાં સાહિત્ય અને અન્ય કળાઓની પણ તુલના થાય છે. સાહિત્ય અને ફિલ્મ કલાઓના આંતર સંબંધની સમજ સ્પષ્ટ થાય અને સાહિત્યકૃતિ તથા ફિલ્મના અભ્યાસ અને આર્થાદ દ્વારા તુલના કરી શકે.

## **Paper : 10 Multi disciplinary : સાહિત્ય અને ફિલ્મ**

**એકમ:૧** (૧) ફિલ્મ: ઉદ્ઘબવ અને વિકાસ  
(૨) ફિલ્મ નિર્માણની પ્રક્રિયા

**એકમ:૨** (૧) સાહિત્ય અને ફિલ્મનો સંબંધ  
(૨) ભારતીય ફિલ્મનો ઇતિહાસ

**એકમ:૩** માનવીની ભવાઈ (ગુજરાતી) નવલક્થા અને ફિલ્મ

**એકમ:૪** સદ્ગતિ (હિન્દી) વાર્તા અને ફિલ્મ

**એકમ:૫** નાનીડ (બંગાળી) વાર્તા અને ફિલ્મ

### **સંદર્ભ પુસ્તકો :-**

૧. ફિલ્મકલા વિચાર - અભિજિત વ્યાસ
૨. ફિલ્માવલોકન - અભિજિત વ્યાસ
૩. પ્રત્યક્ષની લેખમાળા - અમૃતગંગર
૪. સમીપેના લેખો - શિરીષ પંચાલ
૫. દલાલ, યાસીન : ફિલેશબેક.
૬. શેખ, ગુલામ મોહમ્મદ : ભારતીય કળા પરંપરા.
૭. વ્યાસ, અભિજિત : ભારતીય સિનેમા અને ગીત સંગીત.
૮. વ્યાસ, અભિજિત : સાહિત્ય અને સિનેમા.
૯. પટેલ, પ્રમોદકુમાર : કળા, સાહિત્ય અને વિવેચન
૧૦. માનવીની ભવાઈ (ગુજરાતી) નવલક્થા
૧૧. સદ્ગતિ (હિન્દી) વાર્તા
૧૨. નાનીડ (બંગાળી) વાર્તા